



સુરત મહાનગરપાલિકા,
સાઉથ ઝોન-બી(કનકપુર),
સ્વામિનારાયણ મંદિરની
બાજુમાં, કનકપુર, સચિન, સુરત
FAX : 91-0261-2272147
PHONE : 2278429-2277043

કાર્યપાલક ઈજનેર

નં.સા.ઝોન-બી/ટેક/૧૧૩૩
તા.૧૬/૦૫/૨૦૨૬

કામનું નામ :- સાઉથ ઝોન (કનકપુર)-બી માં સમાવિષ્ટ સચીન, કનકપુર-કનસાડ, પારડી-કણદે, પાલી, તલંગપોર અને ઉબેર વિસ્તારોમાં સમ્પ / અંડર ગ્રાઉન્ડ ટાંકીઓ તેમજ ઓવરહેડ ટાંકીઓનો સાફ સફાઈ કરવાનું કામ.

સામાન્ય શરતો (General Conditions)

- (૧) ઈજારદારે સંમીત સાથે બાનાની રકમ પેટે રૂ. ૧૦,૦૦૦/- પે-ઓર્ડર/ડીમાન્ડ ડ્રાફ્ટ, ફક્ત કમિશનરશ્રી, સુરત મહાનગરપાલિકા, સુરતના નામનો અવશ્ય બીડવાનો રહેશે. બાનાની રકમ સિવાયનું ટેન્ડર રદ થવાને પાત્ર રહેશે.
- (૪) સંમીત સાથે કોઈપણ જાતની શરત સ્વીકારવામાં આવશે નહીં. શરતી સંમીત રદ થવાને પાત્ર રહેશે.
- (૫) ઈજારદારે સંમીત ભરતા પહેલા સંબંધિત એન્જીનીયર ઈન્ચાર્જની રૂબરૂમાં સ્થળ વીઝીટ કરી કરવા પાત્ર કામગીરી અંગે માર્ગદર્શન મેળવી લેવાનું રહેશે.
- (૭) ઈજારો મેળવનાર ઈજારદારે ઓર્ડર મળ્યેથી દિન-૧૦(દસ)માં રૂ. ૩૦૦/- + રૂ. ૩૦૦/- + રૂ. ૩૦૦/- કિંમતના ગુજરાત રાજ્યના સ્ટેમ્પ પેપર પર કરારનામું કરવાનું તથા મંજૂર થયેલ રકમના ૨.૦% લેખે સીક્યોરીટી ડીપોઝીટની રકમ રોકડા/ ડીમાન્ડ ડ્રાફ્ટ/ પે ઓર્ડર થી જમા કરાવવાની રહેશે અન્યથા પ્રતિદિવસના વિલંબ પેટે દરરોજના સીક્યોરીટી ડીપોઝીટની રકમનાં ૦.૦૬૫% લેખે પેનલ્ટી વસુલ કરવામાં આવશે.
- (૮) આ કામે ઈજારદાર /ટેન્ડરે લઘુત્તમ ૧૫ લાખ લીટરની ક્ષમતા ધરાવતી ઓવરહેડ ટાંકીની સફાઈનું સરકારી /અર્ધસરકારી સંસ્થાનું પ્રમાણપત્ર હોવું ફરજીયાત છે.
- (૯) દરેક રનીંગ એકાઉન્ટ બીલમાંથી કરેલ કામની રકમના ૭% લેખે રકમ રીટેન્સન મની તરીકે કાપી જમા રાખવામાં આવશે. જે રકમ ફાયનલ બીલમાં છૂટી કરવામાં આવશે.
- (૧૧) સદર કામે ઈજારદારે લેબર લાયસન્સ લેવાનું રહેશે તથા આનુસાંગિક નિયમો- કાયદાનું પાલન કરવાનું રહેશે. વધુમાં, લાયસન્સ મેળવ્યા વગર કામ ચાલુ કરવામાં આવશે તો તેની ઉપસ્થિત સર્વાંગી જવાબદારી ઈજારદારની પોતાની રહેશે.
- (૧૨) આપના દ્વારા રોકેલા/રોકવામાં આવનાર કામદારોને નિયમિત રીતે પગાર પત્રક, હાજરી પત્રક બનાવી ઈ.એસ.આઈ. તથા પ્રોવિડન્ડ ફાળાની રકમ નિયમિત કપાત કરી

કાયદા મુજબ જમા કરાવી ચલણ અત્રે રજૂ કરવાના રહેશે. ઈ.એસ.આઈ., પ્રોવિડન્ડ ફંડ તથા મજૂર અંગેના કાયદાઓનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે તથા આ રીતે સોસીયલ સીક્યુરીટી ક્વરેજ ફાળાની કેટલી રકમ જમા કરવામાં આવી તેની માહિતી, કામદારોની યાદી સહિત પ્રતિ માસ અત્રેની કચેરીને મોકલવાની રહેશે. ઈજારદારે સાઈટ પર રોકેલા બધા કામદારો, મજૂરોનો અકસ્માત વીમો લેવાનો રહેશે.

- (૧૩) ઈજારદાર દ્વારા જે કર્મચારીઓ / કામદારો રોકવામાં આવે તેઓને કોઈપણ સંજોગોમાં લઘુત્તમ વેતનથી ઓછો પગાર આપી શકાશે નહીં.
- (૧૪) ઈજારદાર તરફથી જે માણસો કામ માટે રોકવામાં આવે તે માણસોના પગાર ભથ્થા, રજા વિગેરે કોઈપણ પ્રકારના હકક માટે મહાનગરપાલિકાની કોઈ જવાબદારી રહેશે નહીં તથા તેઓ મહાનગરપાલિકાના કર્મચારી ગણાશે નહીં.
- (૧૫) ઈજારદાર તરફથી રોકવામાં આવેલ કામદારોની સ્થળ પર રહેઠાંણની વ્યવસ્થા થઈ શકશે નહીં. તેઓએ તેમના જરૂરી સાધનો રોજે-રોજ લાવવા/લઈ જવાના રહેશે.
- (૧૬) ઈજારદારના કામદાર / કર્મચારીને કોઈ અકસ્માત / ઈજા થાય અથવા મૃત્યુ તુલ્ય ફેટલ અકસ્માતના સંજોગોમાં સંપૂર્ણ જવાબદારી ઈજારદારની રહેશે અને આ કામગીરી માટે તમામ સલામતીના પગલાં લેવાના રહેશે તેમજ ઈજારદારે સેફ્ટી સાધન જેવા કે, સેફ્ટી બેલ્ટ, સીડી, માસ્ક, ઓકસીજન સીલીન્ડર વિગેરેની વ્યવસ્થા કામની સાઈટ પર રાખવાની રહેશે. તથા આવા કિસ્સામાં સુરત મહાનગરપાલિકા કોઈ વળતર ચુકવશે નહીં કે તેમ કરવા બંધાયેલ નથી.
- (૧૭) આ કામે આખા વર્ષ દરમિયાન જરૂર જણાય ત્યારે જે તે ઓવરહેડ ટાંકીની સાફ-સફાઈની કામગીરી કરાવવામાં આવશે. કોઈ કારણસર ટાંકી સાફ-સફાઈ કરવાનું ન થાય તો કોઈ કલેઈમ કરી શકશે નહીં તથા આવા સંજોગોમાં ઈજારદારની સંમતિ તથા સક્ષમ સત્તાધિશની મંજૂરીને આધિન કામની સમયમર્યાદા વધારી કામગીરી કરાવવામાં આવશે.
- (૧૮) સદર કામનું ચુકવણું જે-તે ઓવર હેડ ટાંકીના એન્જીનીયર-ઈન-ચાર્જ પુરા પાડેલ પ્રમાણિત માપ મુજબ કરેલ સફાઈ કામગીરીનાં માપો લઈ કરવામાં આવશે. જેમાં ફ્લોર એરીયા, સ્લાન્ટ એરીયા, સીલીન્ડરીકલ વોલ, ઈનર સાફ્ટ તેમજ પ્લેટફોર્મ વિગેરેનાં માપો ગણતરીમાં લેવામાં આવશે.
- (૧૯) આ સાથે સામેલ પરિશિષ્ટમાં જણાવેલ વિવિધ ઓવરહેડ ટાંકીઓના માપ ફક્ત જાણકારી માટે છે.
- (૨૦) પરિશિષ્ટમાં જણાવેલ ટાંકીઓ સિવાય અન્ય ટાંકીઓની સફાઈ કરવાની થાય તો પણ મંજૂર ટેન્ડર મુજબ કરી આપવાની રહેશે.

(૨૧) સરકારશ્રીનો કોઈ પણ પ્રકારે સર્વિસ ટેક્ષ કામગીરીનાં સમયગાળા દરમ્યાન લાગુ પડે તો, તે સુરત મહાનગરપાલિકા ભોગવશે પરંતુ તે અંગે ના અધિકૃત પુરાવા સફળ ઈજારદારે સુરત મહાનગરપાલિકામાં દિન-૩૦ (ત્રીસ) માં જમા કરાવવાના રહેશે ત્યારબાદ સુરત મહાનગરપાલિકાની આવા પ્રકારના સર્વિસ ટેક્ષ ચૂકવવા અંગે કોઈ પણ જવાબદારી રહેશે નહીં એટલે દિન-૩૦ (ત્રીસ) બાદ ઈજારદારે રજૂ કરેલ

અધિકૃત પુરાવાનું સુરત મહાનગરપાલિકા વળતર ચૂકવશે નહીં જે અંગે સ્પષ્ટ નોંધ લેવી. તે સિવાયના કોઈ પણ લાગુ ટેક્ષ ઈજારદારના બીલમાંથી સુરત મહાનગરપાલિકા સરકારના નીતિ-નિયમ મુજબ કાપી શકાશે.

(૨૨) સુરત સ્થિત ઈજારદારે, ગુજરાત રાજ્ય વ્યવસાય, વ્યાપાર, ધંધા અને રોજગારવેરા અધિનિયમ-૧૯૭૬ હેઠળ વ્યવસાયવેરા નોંધણી (ઈ.સી. અને આર.સી.) અંગેના પુરાવા તેમજ વ્યવસાયવેરો ભર્યાની રસીદ અત્રેથી માંગવામાં આવે ત્યારે રજૂ કરવાની રહેશે.

(૨૩) સદર કામે સ્વીકારવામાં આવેલ ટેન્ડરના ટેન્ડરે, ટેન્ડરમાં જણાવેલ કામગીરીમાં રોકાયેલ તમામ કામદાર, સુપરવાઈઝર, કોન્ટ્રાક્ટર તથા જે સાઈટ પર કામગીરી કરતાં હોય તેઓ તમામની "Workman Compensation Policy" અને થર્ડ પાર્ટીની ઈન્સ્યોરન્સ પોલીસી લેવાની રહેશે. આ પોલીસી કોન્ટ્રાક્ટરનાં નામે મેળવી અત્રે સંબંધિત અધિકારીશ્રીને જમા કરાવવાની રહેશે.

sd/-

કાર્યપાલક ઈજનેર,
સુરત મહાનગરપાલિકા.

ઈજારદારની સહી:—

સરનામું:—

તારીખ:—

Name Of Work :- Cleaning of Sump / Underground Tank and Overhead Tank in Various Area of Sachin, Kanakpur-Kansad, Pardi- Kande, Pali, Talangpor and Umber Area of South Zone-B (Kanakpur).

ANNEXURE								
અનુક્રમ		લોકેશન	પ્રકાર	Capacity	Unit	Rate Include GST	Amount Include GST	
1.	સચિન	સચિન સ્ટેશન	સમ્પ	3,00,000.00	Liter			
			ESR	7,00,000.00	Liter			
		જલારામ નગર સચિન	સમ્પ	10,00,000.00	Liter			
			ESR	5,00,000.00	Liter			
2.	કનકપુર કનસાડ	કનકપુર કનસાડ ઓફિસની બાજુમાં	સમ્પ	35,75,000.00	Liter			
			કનસાડ રટ ગાળા પાસે	સમ્પ	7,10,000.00	Liter		
		ઉમિયાનગર સોસાયટી	સમ્પ	40,000.00	Liter			
		રાધા કૃષ્ણ સોસાયટી	સમ્પ	27,000.00	Liter			
		ગણેશનગર સોસાયટી	સમ્પ	85,000.00	Liter			
		સ્નેહમિલન સોસાયટી	સમ્પ	1,00,000.00	Liter			
		આશાપુરી સોસાયટી	સમ્પ	1,00,000.00	Liter			
		વૃંદાવન સોસાયટી	સમ્પ	35,000.00	Liter			
		કનકપુર કનસાડ ઓફિસની બાજુમાં	ESR	17,70,000.00	Liter			
3.	પારડી કણદે	શિવશક્તિ સોસાયટી	સમ્પ	2,50,000.00	Liter			
			કરૂણાપાર્ક સોસાયટી	સમ્પ	1,50,000.00	Liter		
			પારડી સીવિક સેન્ટરની બાજુમાં	સમ્પ	2,50,000.00	Liter		
4	પાલી	વિષ્ણુનગર	સમ્પ	3,00,000.00	Liter			
5	તલંગપુર	તલંગપુર પ્રા.શાળાની બાજુમાં	ESR	1,40,000.00	Liter			
			તલંગપુર તળાવની બાજુમાં	ESR	60,000.00	Liter		
		તળાવફળિયુ હળપતિવાસ પાસે	સમ્પ	3,00,000.00	Liter			
6.	ઉબેર	ઉબેર પ્રા.શાળા પાસે	ESR	1,00,000.00	Liter			
			સમ્પ	75,000.00	Liter			
		હળપતિવાસ મહાદેવ મંદિર પાસે	ESR	75,000.00	Liter			

Note- (1) Contractor has to fill rates for a unit of liter as a consolidated item. The rate shall be quoted in figure & words. if there is any discrepancy the rates quoted in words will be considered as final.

I / We the undersigned had visited the work site, studied the scope of work to be carried out, tender terms, condition and specification and quoted the rate accordingly.

Signature of Contractor :-

address :-

sd/-

**Excutive engineer
South Zone -B(Kanakpur)
Surat Municipal Corporation**

GST CLAUSE :-

GST CALUSE FOR CONSTRUCTION/ ERECTION/ COMMISSIONING/ INSTALLATION/ REPAIRS MAINTENANCE / RENOVATION / FABRICATION OF STRUCTURE INCLUDING BUILDING (MEANS ALL WORKS CONTRACT / TURN KEY PROJECTS / SUPPLY OF MATERIAL / GOODS)

GST (Goods and Service Tax) has come in existence from 1st July 2017. Contractor /Successful Bidder is bound to pay any amount of GST prescribed by the Govt. of India as per the Terms of Contract agreed upon during the course of execution of this Contract.

During the course of execution of Contract, if there is any change in Rate of GST (Goods and Service Tax) by the Government, the same shall be reimbursed / recovered separately by SMC, subject to the submission of Original Receipt / Proof for amount actually remitted by the successful Tenderer / Contractor to the competent Authority along with a certificate form Chartered Accountant of Contractor / Successful Bidder Certifying that the amount of GST paid to the Government and the same shall be intimated / submitted /claimed within 30 (Thirty) Days from the date of payment. Remittance of GST within stipulated period shall be the sole responsibility of the Successful Bidder / Contractor, failing which, SMC may recover the amount due, from any other payable dues with SMC and decision of Municipal Commissioner shall be final and binding of the Contractor / Successful Bidder in this regard. Further, the non-payment of GST to the Government may lead to the termination of contract and forfeiture of security Deposit/ Performance Guarantee Amount.

If Imposition of any other new taxes / Duties /Levies / Cess or any other incidentals etc. or any increase in the existing taxes / Duties / Levies / Cess or any other incidentals etc. (Excluding GST) are imposed during the contract, the same shall be borne by contractor / successful Bidder only, in no case SMC shall be liable for the same.

sd/-

**Excutive engineer
South Zone -B(Kanakpur)
Surat Municipal Corporation**

Signature of Contractor :-

address :-

Date :-